

હવે IIT ગાંધીનગરમાં જાપાનીઝ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરશે

નવગુજરાત સમય > અમદાવાદ

આઈઆઈટી ગાંધીનગર ખાતે જાપાનથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવી શકે તેવું એક શેરિંગ માટેનું કોલોબ્રેશન કરાયું છે. શનિવારે જાપાન એડ્વાન્સ્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ચાર સભ્યોનું એક ડેલિગેશન આઈઆઈટી ગાંધીનગરની મુલાકાતે આવ્યું હતું. જે મુલાકાત દરમિયાન આ નિર્ણય લેવાયો છે.

જાપાન એડ્વાન્સ્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રેસિડેન્ટ ડૉ. તેત્સુ અસાનોએ જણાવ્યું કે, 'અમે ઈન્ટરડિસીપ્લિનરી સ્ટડી માટે વિદ્યાર્થીઓની એક ટીમ આઈઆઈટી ગાંધીનગર ખાતે મોકલીશું. છેલ્લા કેટલાક



વર્ષોથી અમારે ત્યાં ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પણ હવે પ્રથમ વખતે અમારા વિદ્યાર્થીઓ ભારતમાં આવશે.'

આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર સુધીર જૈને કહ્યું કે, 'બંને સંસ્થાઓને બંને દેશોમાં રહેલી તકો અને અનુભવોને એકબીજા સાથે વહેંચવાની તક મળશે અને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય પ્રવાહોને સમજી શકશે'